



**D-1601270102010100**

Seat No. \_\_\_\_\_

**M. A. (Sem. I) Examination**

**March - 2022**

**Psychology**

*(Advance Experimental Psychology Theory)*

*(Old Course)*

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સૂચના : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.  
(2) કોઈ પણ પાંચ પ્રશ્નના ઉત્તર આપો.

- |    |   |    |
|----|---|----|
| 1  | પ્રાયોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો.                     | 14 |
| 2  | પ્રાયોગિક યોજના એટલે શું ? પ્રાયોગિક યોજનાની વિગતે સમજૂતી આપો.              | 14 |
| 3  | પ્રેરણાના પ્રમાણ માત્રામાં ફેરફાર કરવાની પદ્ધતિ સમજાવો.                     | 14 |
| 4  | ધ્યાનનો અર્થ આપી ધ્યાનનું સ્વરૂપ સમજાવો.                                    | 14 |
| 5  | હતાશાનું સ્વરૂપ જણાવી હતાશા સર્જવાની પદ્ધતિઓ વર્ણવો.                        | 14 |
| 6  | સાધનાત્મક અભિસંધાન સમજાવો.  | 14 |
| 7  | મનોભૌતિક પદ્ધતિ તરીકે સરેરાશ ભૂલની પદ્ધતિ સમજાવો.                           | 14 |
| 8  | શ્રવણના શારીરિક આધારો સમજાવો.   | 14 |
| 9  | ટૂંકનોંધ લખો :<br>(1) શિક્ષણનું વ્યવસ્થાપન<br>(2) પ્રતિક્રિયા સમયનો ઉપયોગ   | 14 |
| 10 | ટૂંકનોંધ લખો :<br>(1) પ્રયોગના પરિવર્ત્યો<br>(2) પ્રયોગ નિયંત્રણની પદ્ધતિઓ. | 14 |

## **ENGLISH VERSION**

**Instructions :** (1) All questions carry equal marks.  
(2) Answer any five questions.

- |           |  |           |
|-----------|--|-----------|
| <b>1</b>  | Explain the nature and scope of experimental psychology.                                   | <b>14</b> |
| <b>2</b>  | What is experimental design ? Explain in details experimental design.                      | <b>14</b> |
| <b>3</b>  | Explain the experimental operations influencing motivation.                                | <b>14</b> |
| <b>4</b>  | Give the meaning of Attention and Determinants of Attention.                               | <b>14</b> |
| <b>5</b>  | State the nature of frustration. Explain the methods used to product frustration.          | <b>14</b> |
| <b>6</b>  | Explain the operant conditioning.  | <b>14</b> |
| <b>7</b>  | Explain the method of average error of psycho-physical method.                             | <b>14</b> |
| <b>8</b>  | Explain the physiological basis of Audition.   | <b>14</b> |
| <b>9</b>  | Write short notes :<br>(1) Management of learning<br>(2) Use of reaction time              | <b>14</b> |
| <b>10</b> | Write short notes :<br>(1) The variables of experiment<br>(2) Control method of experiment | <b>14</b> |

